

(સ. મૂ. ૧.) — વાય-૫૧૩૦ — ૧૦,૦૦,૦૦૦ — ૧૧-૨૦૦૮.

ફોર્મ નં. ૨

### મરણ રિપોર્ટ

અંકડાકીય માહિતી

આ ભાગ મરણ રજિસ્ટર સાથે જોડવો.

### માહિતી આપનારે ભરવું

૧. મરણની તારીખ :
૨. કે મરનારનું નામ :

  - એ મરનારના પિતા/પતિનું નામ :
  - ગ મરનારના માતાનું નામ :

૩. મરનારની જાતિ : (પુરુષ/સ્ત્રી)
૪. મરનારની ઉંમર :

  - (૧ વર્ષથી વધુ હોય તો પૂર્ય વર્ષમાં, ૧ વર્ષથી ઓછી હોય તો પૂર્ય મહિનમાં,  
૧ મહિનથી ઓછી હોય તો પૂર્ય દિવસમાં અને જો ૧ દિવસથી ઓછી  
હોય તો પૂર્ય કલાકમાં વાંચો).

- ૫-એ મરનારનું ડાયમી રહેશાળાનું સરનામું :
- ૫-બે મૃત્યુ સમયે મરનારનું સરનામું :
૬. મરણનું સ્થળ :

  - ૧. દ્વારાનું સંસ્થા હોય તો નામ સરનામું
  - ૨. ઘર
  - ૩. અન્ય સ્થળ

૭. માહિતી આપનારનું નામ/સરનામું :

તારીખ : માહિતી આપનારની સહી અથવા  
ડાબા અંગૂઠાનું નિશાન.

(ડોલમ ૧ થી ૧૮ બાંધ જ પૂર્ણ બર્યા બાદ, માહિતી આપનારે અહીં તારીખ  
તથા સહી કરવો.)

### રજિસ્ટ્રારે ભરવું

- |                       |                           |
|-----------------------|---------------------------|
| નોંધણી નંબર           | નોંધણી તારીખ              |
| જિલ્લો                |                           |
| શહેર/ગામનું નામ :     |                           |
| રિમાર્ક્સ (જો હોય તો) | રજિસ્ટ્રારનું નામ અને સહી |

### મરણ રિપોર્ટ અંકડાકીય માહિતી

આ ભાગ કાપીને અંકડાકીય પ્રક્રિયા માટે ફોર્મ નં. ૧૨ માં માસિક  
સમરી રીપોર્ટ સાથે તાલુકા રજિસ્ટ્રારને મોકલવો.

ફોર્મ નં. ૨

### માહિતી આપનારે ભરવું

૮. મરનારનું રહેશાળાશ :

  - (એ) રાજ્યનું નામ : ગુજરાત
  - (બ) જિલ્લાનું નામ :
  - (ક) તાલુકાનું નામ :
  - (દ) શહેર / ગામનું નામ :

૯. ધર્મ :
૧૦. મરનારનો ધંધો :
૧૧. મરણ પહેલાં કોઈ તથીભી સારવાર મળી હોય તો તેનો  
પ્રકાર :

  - ૧. સંસ્થાકીય.
  - ૨. અન્ય-સંસ્થાકીય સિવાયની.
  - ૩. તથીભી સારવાર મળી નથી.

૧૨. મરણનું કારણ તથીભી રીતે પ્રમાણિત થયેલું છે ?

  - ૧. હા ૨. ના

૧૩. રોગનું નામ અથવા મરણનું ખરેખર કારણ :-
૧૪. જો સ્ત્રી મરણ હોય તો સદરહુ મરણ સગભરવસ્થામાં પ્રસૂતિ  
દરમાન અથવા પ્રસૂતિ બાદ હ અઠવાટિયામાં થયેલ છે

  - ૧. હા ૨. ના

- ૧૪-એ કેમ-૧૪ ની વિગત હા હોય તો મૃતકનું શિક્ષણ સ્તર :
૧૫. મૃતકને ધુમ્રપાન કરવાની ટેવ હોય તો કેટલા વર્ષથી ? :
૧૬. જો કોઈ પણ રીતે તમાકુ ચાવવાની ટેવ હોય તો કેટલા વર્ષથી ? :
૧૭. સોપારી ખાવાની ટેવ હોય તો (પાન મસાલા સહિત)  
કેટલા વર્ષથી ? :
૧૮. દાડ પીવાની ટેવ હોય તો કેટલા વર્ષથી ? :

(માહિતી ભરવાના કોલમ પૂર્ણ થયા બાદ ડાબી બાજુ સહી કરવી)

### રજિસ્ટ્રારે ભરવું

- જિલ્લો :
- તાલુકા :
- શહેર/ગામનું નામ :
- વસતિ ગઢાતરી મુજબ ગામ/શહેરનો કોડ નં. :

### નોંધણી તારીખ :

- નોંધણી નંબર :
- જાતિ : (પુરુષ/સ્ત્રી જે હોય તે  
સ્પષ્ટ લખવું)
- મરણ તારીખ :
- સ્પષ્ટ લખવું)
- ઉંમર : વર્ષ/માસ/દિવસ/કલાક (સ્પષ્ટ ઉંમર લખવી) :
- મરણનું સ્થળ :- ૧. દ્વારાનું / સંસ્થા ૨. ઘર ૩. અન્ય સ્થળ  
રજિસ્ટ્રારનું નામ અને સહી

ફોર્મ નં. ૨ (જુઓ નિયમ - ૫) મરણ રિપોર્ટ ફોર્મ